



જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૭/૦૨/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૭૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૯ વ્યક્તિઓને ઝડપી, ૨૮ લીટર દેશી દારૂ, ૮ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૧,૪૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૭૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૩૭૯/૧૯

ચાંદખેડા: રાણાભાઈ સાદુળજી રાજપૂત (રહે.રૂપાણીવાસ સુઇગામ તા-સુઇગામ જી-બનાસકાંઠા) એ તા.૨૬/૨/૧૯ ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૬/૦૫/૨૦૧૬ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) પ્રકાશભાઈ લક્ષમણભાઈ પ્રજાપતિ (૨) શિવાકાંત રામાભાઈ પંડીત (બંને રહે. મલબારી એપાર્ટમેન્ટ ચાંદખેડા) એ ભેગા મળી રાણાભાઈની એક્સ.યુ.વી.ગાડી નંબર જીજે-૧૮-બી.ડી-૭૧૭૧ રૂપિયા ૧૩,૫૧,૦૦૦/- માં વેચાણ લઈ, તે પેટે રૂપિયા ૩,૫૧,૪૦૦/- આપી, બાકીની રકમના ઇન્ડિયન બેંક ચાંદખેડાની શાખાના અલગ-અલગ ચેક આપી, રાણાભાઈને વિશ્વાસમાં લઈ, ટી.ટી.ઓ ફોર્મ ઉપર સહી કરાવી રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ના ચેક કલીયર કરાવવાના બહાને પાછા મેળવી લઈ લઈ, ચેક કલીયર નહિ કરાવી તેમજ રૂપિયા નહી ચુકવી રાણાભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એલ.સોલંકી ચલાવે છે.

કાલુપુર: ચેતનકુમાર બટ્ટકભાઈ ભીમાણી (રહે.ઇન્દ્રજીત સોસાયટી વિભાગ-૨, નિકોલ ગામ રોડ, ઠક્કરબાપાનગર) એ તા.૨૬/૦૨/૨૦૧૯ ના રોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૧૨/૨૦૧૭ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાનમાં કાલુપુર, ઘી કાંટા રોડ, વૈભવલક્ષ્મી માર્કેટ દુ.નં.જી-૫૮ માં “રાધેલક્ષ્મી ક્લોથીંગ એન્ડ ગાર્મેન્ટ” નામની ચેતનકુમારની દુકાનમાંથી આરોપી (૧) વિષ્ણુભાઈ કાંતીભાઈ પ્રજાપતિ (રહે.”પ્રિયંકા ફેબ્રીક્સ”, મનિષ કોમ્પલેક્ષ, સોનાવાલા કોસ રોડ, ગોરેગાંવ સ્ટેશન નજીક, ગોરેગાંવ ઇસ્ટ, મહારાષ્ટ્ર) (૨)રાજન દલીયંદ ભાવસાર (“સોની ફેશન” તથા “રવિદીપ એન્ટરપ્રાઇઝ બીજો માળ, ક્રિસ્ટલ પ્લાઝા, મલાડ, મુંબઈ) અને (૩) અરૂણ ભાનુશાળી (“મલક એન્ટરપ્રાઇઝ”, સમર્પણ બિલ્ડીંગ, ન્યુ માણેકલાલ, ઘાટકોપર વેસ્ટ) એ ભેગા મળી ચેતનકુમારનો વિશ્વાસ કેળવી, જુદી-જુદી રકમનો કુલ રૂપિયા ૧૦,૫૧,૨૫૫/- મતાનો કાપડના પેન્ટના માલનો ઓર્ડર મુજબ મોકલી આપેલ હોવા છતાં તે પેટે ચુકવાના બાકી નાણા ૯,૩૧,૨૫૫/- આજદિન સુધી ચેતનકુમારને નહી ચુકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી રોહીતસિંહ લક્ષ્મણસિંહ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૩૮૦/૧૯

શહેરકોટડા: મગસિંહ દુર્ગસિંહ રાજપુરોહિત (રહે.ઇન્ડિયા બુલ્સ ફ્લેટ, હરીભાઇ ગોદાણીના દવાખાના પાસે, સરસપુર) એ તા.૨૬/૦૨/૧૯ ના રોજ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૦૨/૧૯ રાતના ૯/૦૦ થી તા.૨૫/૦૨/૧૯ સવારના ૧૧/૦૦ વાગ્યા દરમિયાન અમદુપુરા સફલ-૪, ખાતે આવેલ પોતાની “ભાવીકા ગારમેન્ટ” નામની દુકાનનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી ડ્રોવરમાં મુકેલ રોકડ રૂપિયા ૨૫,૦૦૦/- તથા રેડીમેન્ટ પેન્ટ-શર્ટ મુકેલ બે થેલા જે તમામ રેડીમેન્ટ પેન્ટ-શર્ટની કુલ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫૫,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એસ.પરમાર ચલાવે છે.

સરદારનગર: પ્રવિણચન્દ્ર સોમાભાઇ ચાવડા (ઉ.વ.૫૬)(રહે.સમૃધ્ધી રેસીડેન્સી ઘરવખરી ફર્નીચર શો રૂમની બાજુમા મોટેરા ચાંદખેડા) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૨/૨૦૧૯ રાતના ૧૧/૫૭ થી તા.૨૬/૦૨/૨૦૧૯ સવારના ૧૦/૧૫ વાગ્યા દરમિયાન નોબલનગર ટી ખાતે આવેલ સુદામા પાર્ક શોપીંગ સેન્ટર સ્વામીનાયણ મંદિરની બાજુમા આવેલ એ.ટી.એમ.માં કોઇ અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, એ.ટી.એમ. ના સાઇડનો ભાગ ગેસ કટર વડે કાપી, તેમાંથી રોકડ રૂપિયા ૭,૯૫,૨૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જે.સી.શેખ ચલાવે છે.

ત્યજી દિઘેલ મૃત ભૂણ મળી આવવા બાબત:-

સમાચાર યાદી નં.૩૮૧/૧૯

કાગડાપીઠ: તા.૨૬/૦૨/૧૯ કલાક ૮/૩૦ વાગ્યા પહેલા ગીતા મંદિર રોડ મજુરગામ ત્રણ રસ્તા પાસે કચરાપેટીના ડબ્બા નજીકથી નવજાત ભૂણ મૃત અવસ્થામાં ત્યજી દિઘેલ હાલતમાં મળી આવતા કાગડાપીઠ પોલીસે અજાણી વ્યક્તિ વિરૂધ્ધ ગુનો નોંધી આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એલ.વાઘેલા ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૩૮૨/૧૯

“એમ” ટ્રાફિક પોલીસ સ્ટેશન: મહમદ અમીન ઈસ્લાઈલભાઈ અબ્દાલ (રહે.સુકુન રો હાઉસ ઈબ્રાહીમ મસ્જીદ પાસે ફતેવાડી કેનાલ સરખેજ) એ “એમ” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૨/૧૯ સવારના ૯/૩૦ વાગ્યાના સુમારે ફતેવાડી કેનાલ તરફ જતા અલીજા બિલ્ડીંગ સામેથી ગુલામસબર ઈસ્લામભાઈ અબ્દાલ (ઉ.વ.૨૮) પોતાનું મોટર સાયકલ ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટેન્કર નંબર જીજે ૦૧ ટીટી ૯૫૦૫ ના ચાલક મહેમુદ હુસેન બાબુભાઈ મલેકે ટેન્કર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી મોટર સાયકલને ટક્કર મારતા ગુલામસબર ઈસ્લામભાઈ અબ્દાલ ઉપર ટેન્કરનું ટાયર ફરી વળતા ગંભીર ઈજાઓ થતા સ્થલ ઉપર જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનાની તપાસ ઈન્ચા.પો.ઇ.શ્રી ઝેડ.આઈ.શેખ ચલાવે છે

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.